



જયંત પાઠકની કવિતામાં અધ્યાત્મભાવ

અમીતા ભટ્ટ

જયંત પાઠક ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય કવિ ગણાય છે. તેઓ મુખ્યત્વે વતનપ્રેમનાં, વતન જુરાપાનાં તથા 'વાડાના શ્વાસ'ના કવિ ગણાય છે. તેમની કવિતાનો અભ્યાસ કરતાં, તેમની કેટલીક કવિતામાં અધ્યાત્મનો રંગ ઉંડ ઉંડ પ્રગટ્યો જાગાય છે. તેમની અધ્યાત્મભાવની રચનાઓ હદ્યના સાચા સંવેદનમાંથી સજીવીલી જગાય છે. અને આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ નોંધપાળું બને છે. આ પ્રકારની રચનાઓ કાવ્યત્વની દ્રષ્ટિએ પણ ખાસ નોંધપાળું બની છે.

'મર્મર'ની તેમજ અન્ય કાવ્યગ્રંથોની ઘરૂંની કવિતામાં તો જીવનની, જીવસૂચિની અને બનાંડની લીલા-વિસ્મયનું દર્શન થાય છે. તેમજ મહર્ષિ અરવિંદના વિચારો અને આધ્યાત્મિક વિચારધારાનો સુયોગ પણ આગળ તરી આવે છે. 'ચરણઠેસથી' માં જગ્યાવ્યું છે:

"ચરણઠેસથી

જુ શલ્યા બની સજીવ અહંકાર,
આદિંગનથી બન્યાં અંગ સૌ કુજીનાં ઘાટીલાં,
હે સુંદર ગોવિંદ,
તુજ સ્પર્શી આ પંક વિશે શું નહીં પ્રગટે અરવિંદ? (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૫૭)

આ મુક્તકરચનામાં 'અરવિંદ' શબ્દમાં રહેલો શ્વેષ સહેજે વંજિત થતોઅનુભવી શકાય છે. કવિની આધ્યાત્મિક આરત 'ચાહું' માં પ્રબળતા અને સ્પષ્ટતાથી પ્રગટ થાય છે:

"હું આત્મામાં વ્યાપ્ત, હે છિન્ન, ગૂઢ !

મારી સૌઅં વાસનાનો વિમૂઢ
આજે તારા દર્શને જાય જાગી,
દીડ તારી મેર માનિલય ત્યાગી.
પામો સૌ ન્યૂનતાઓ મુજી,
તુજ સ્પરશે પૂર્ણતામાં પબોધદ" (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૫૮)

આ કવિતામાં જે 'પૂર્ણિતા' માં શબ્દનો વિનિયોગ થયો છે. એ ઉપરાંત એમાં અન્ય એક પંક્તિમાં 'એતના' શબ્દ પણ પથોજયો છે, તેમાં અરવિંદ દર્શનની છાયા જ ભાવક અનુભવે છે. સંસાર રસ માં, જગતની વિસ્મયપ્રેરક રમણીય લીલામાં, અતીતરાગમાં તેમજ માનવીય સંવેદનાઓમાં રમમાણ રહ્યા હોવાથી અધ્યાત્મભાવન તેઓ પ્રબળતાપૂર્વક આગળ કરતા નથી. અધ્યાત્મભાવના નિરૂપણમાં પણ સર્જનની આનંદલીલા જ મુખ્યત્વે પ્રવર્તતી રહેવી જોઈએ. તેઓની અધ્યાત્મભાવની કે અધ્યાત્મસૂચક રચનાઓમાં પણ ભક્તિભાવ કે શ્રદ્ધારતિ કરતાં વિસ્મય અને આનંદનું જ મહત્વ જોવા મળે છે. કિવિના અધ્યાત્મભાવમાં પણ સકલ માનવપ્રેમની મહતા અને વૈશ્વિક વિસ્મયના ઉદ્ગાર પ્રગટ થાય છે. 'એતબાર આપે' નામની રચના જુઓ:

"કોઈ મને એતબાર આપે

એટલો, બસ એટલો જ કરાર આપે;
ક નથી જુદી જગતથી હું,
દોડુ ભલે જુદી નજરથી હું." (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૯૩)

કવિ આ કવિતામાં માનવજીવનના નાના નાના અને સામાન્ય બ્યવહારોમાંથી પ્રગટ થતો આનંદ જ વ્યક્ત કર્યો છે. કવિને વિચાર આવે છે કે એ એ જગતથી જુદો તો નથી ને? આ કવિ તો કોઈ અગમ્ય કે અકળ વિશ્વનિયંત્રાને જુગાવે છે કે ‘નથી જુદો જગતથી હું.’

અધ્યાત્મભાવની રચનાઓમાં પ્રકૃતિની સૌદર્યલીલા અને માનવતાનું માધુર્ય પ્રણ પ્રગટે છે. ‘ખોટી ચીજ’ નામની કવિતામાં દર્શાવે છે;

‘ખપે ન ખોટી ચીજ
અમને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહુ વરસાદ ગગનથી,
નાંડિ ગરજન, નાંડિ ચીજ.
તુજ-મુજ પ્રીતને દાવે માગું
તારું સકલ, નહીં યાચું
પૂર્ણ સુધાર સંકુલ પૂનમનો પીવો,
ન ઘૂંઠડી બીજ. (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૧૪)

કૃષ્ણ-ગોપીના પ્રેમભાવને ‘મુખ જો કરું’ કવિતામાં સારી રીતે અભિવ્યક્તિ કર્યો છે. અને તેમાં પ્રેમ જંખનાની અનન્ય ભાવના પ્રણ વિશેષ રીતે પ્રદર્શિત કરી છે. ‘મત ભટકો’ કવિતામાં પ્રણ અધ્યાત્મભાવની આરત અદ્ભૂત રીતે રજૂ થઈ છે:

‘મન ભમરા રે મત ભટકો
એક વખત લાગ્યો
ના છૂટશે ચંચળતાનો ચટકો.’ (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૧૫)

પરમતત્ત્વન પામવાની અને તેને શરાગે જવાની ઉત્કટ જંખના આ કવિએ સારી રીતે વ્યક્ત કરી છે. અને તેમાં પ્રણ અનેરું કાવ્યસૌદર્ય પ્રગટે છે.

‘રત રતના ઝૂલના પ્રાશન,
દલ દલના કોમલતમ આસન,
આ જગભાગ વિશે આકર્ષક
કલી કલીનો લટકો.’ (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૧૫)

કવિએ આધ્યાત્મિકતાની સાથે સાથે શબ્દાર્થની સુંદરતાને પ્રગટાવી છે, તેથી કાવ્ય આસ્વાદ બને છે. ‘તવ ચરાગે’ અને ‘દિનાંજે’માં પ્રણ ‘મત ભટકો’ની જેમ ભાવસૌદર્ય અનેરી રીતે પ્રગટે છે.

‘આ જીવનની જમનાનાં જલ
વહે ચરાગ તુજ ધોતાં..’ (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૧૭)

કવિની કવિતામાં કૃષ્ણ-ગોપીના પ્રણયભાવનો, પ્રેમલક્ષ્મા ભક્તિનો, આધ્યાત્મિક પ્રેમનો અર્થાત કોઈ પરમ તત્ત્વની ખાજને પામવાની સ્પૃહા ‘મુખ જોયા કરું’માં અભિવ્યક્ત થઈ છે:

‘મુખ જોયા કર ફરી ફરી
ચેન પડ ના તુમ બિન, એવુ કામણ જાવ કરી.’
“ એકલડી ઇ સાવ આજ તો, મોહન જાવ ફરી,
મુખ જોયા કર ફરી ફરી.” (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૧૫)

આ કવિતા પરંપરાગત લાગે છે, પરંતુ તેમાં ભરપુર કાવ્યતત્ત્વના કારણે તે નિર્જળ ફૂતિમાંથી ઉગરી જાય છે. શ્રીકૃષ્ણ પત્નીની અન્દિની આરત તેમના કાવ્યમાં વિશિષ્ટ ભાવ જન્માવે છે.

કીકીઓમાં કેદ કરી લીધા મેં કાનજીને

કીકીમાં કેદ કરી લીધા!

ભોળી નથી કે હવે લોચન ઉઘાડું

છીને-વગડામાં વાંસળીઓ વાગે: (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૧૭૪)

અધ્યાત્મભાવની કવિતામાં જીવનને ઉન્નત કક્ષાએ પહોંચાડવાની અદ્યમ જંખના વ્યક્ત થાય છે, તદઉપરાંત તેમાં જીવનની વ્યાકુળતા પણ અનહં રીતે વિસ્તરે છે. ‘અજવાળા’માં એનું આદેખન અદ્ભૂત પરિમાણ વ્યક્ત કરે છે;

હવે બંધ આંઝે દેખાતી

ચૌદ લોકની લીલા,

અંધકારના સર્પ પછાડી

ક્રુણ પડયા સૌ ઢીલા.

ભર્યા ભર્યા વન ધોર મરણની ગ્રાદ-ચીસથી ઠાલા! (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૩૬૬)

આ જગતમાં શાશ્વત કશું નથી, શાશ્વતને પામવા માટે હરફંમેશ પરમતત્ત્વની ઉપાસના જરૂરી બને છે અને તે વેળા સાંસારિક આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બની જવાય તો જ મિથ્યાભાવનો લોપ થઈ જાય અને ભીતરના સાચો રણકો સંભળાય છે. ‘પદ’ નામની રચનામાં દર્શાવે છે:

“અંખોના વશવાસે રૈયે ના ભાઈ મારા

દલું દેખે એ જ સાચું;

ભીતર-નીભાડાના અભિનની આંચ વના

નળિયું રૂપાણું તોય કાચું.” (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૨૧૫)

કોઈ પણ વ્યક્તિ મોહમાયાના બંધનમાં ફસાઈ જાય તો તેઓ અંદરોઅંદર તેમાં ખૂંપી જઈને નિજુ દુનિયામાં જ રાચે છે; તેના બદલે આત્મોધ્યારક પ્રવૃત્તિ ને મહત્વ આપે તો તે શ્રીયસ્કર પણ બની રહે છે. તેઓ પોતાની મર્યાદાથી વાકેફ હોવાથી તેને દૂર કરવા માટે સદગુરુને પ્રાર્થી છે:

ગુરુજુ, તમે કંઠી બાંધો તો એવી બાંધો

કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરી,

ગુરુજુ, તમે માળા આપો તો એવી આપો

કે કેરવતા કરતું મન ધીર થાય ધડી. (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૪૨૩)

દુન્યવી સ્વાર્થમાં પરમતત્ત્વની સાચી ઓળખ થતી નથી. પરંપરાગત આધ્યાત્મિક પવૃત્તિઓ અને ખોટા ખોટા દાવાઓ પ્રત્યે વક્તાનો અણસાર આપોઆપ પ્રવેશે છે. ‘પાનબાઈનો વલોપાત’માં મધ્યકાલીન ભજનશૈલીના ઠણમાં લખાયેલી રચનામાં જીવાત્માનો વલોપાત જ આદેખાયો છે:

“અવળા ને સવળા આવે વાયરા, ને

પાનબાઈ કફકે છે જીવું પાંદ જુ,

સૂરજ ઉગે ના, તારો એક તરો ના જણી

કકડાય ચળકે નણી ચાંદ જુ,

એવા અંધારે મારે કીકીમાં કેમ કરી

મરવાં તે ભર્યા ભરમાં જુ!” (ક્ષાળોમાં જીવું છું, પૃ. ૪૨૨)

કવિના અધ્યાત્મભાવના કાવ્યોની સંખ્યા વધારે નથી, ઇતાં એમાં પ્રગટાં ચિંતન અને પ્રમત્તવની ઝંખના અદ્દીય છે અને તેમાં મુખ્યત્વે તો સાચું કાવ્યત્વ જ વિલસતું જોવા મળે છે, તે કવિની સિદ્ધિ છે. ‘અજવાળાં’, ‘દૂર નથી’, ‘હું અદીઠ’, ‘શ્વેત શિખરના શિરે’, ‘તું જ’, ‘ગુરુજી તમે’, ‘બોલ’, ‘ગુરુજી માટે’, ‘તને’, ‘મળીએ’, ‘વીજ જબકે છે’ વગેરે કાવ્યોમાં કાવ્યત્વની સાથે સાથે અધ્યાત્મભાવ પ્રબળતાથી વ્યક્ત થયો છે.

કવિના અધ્યાત્મભાવના કાવ્યોમાંથી ભક્તિભાવ કે અકળ તત્ત્વને પામવાની આસને બદલે વિરાટ વિશ્વનું વિસ્મય જ મુખર રીતે પ્રગટે છે:

એક જોગી જોયો જતો

અધોર જુંગલ-વાટે આ પણ અલોપ, ઓ પણ છતો!

શર પર ઊડે જટૂરિયાં

તે જીવતો જાણો નાગ,

ભસમ મટે ભટ્ટીથી

જાણે અરણી પ્રગટે આગ!

ખડ ખડ ફસતો જતો

આમ ચઢે આ પળ, બીજી પળ પાતાળમાં ઉત્તરતો! (ક્ષાળોમાં જીવું છું, પૃ. 390)

અહીં ‘જોગી’ તે વિરાટનું પ્રતિક હોવાનું સમજાય છે. અને એનું વર્ગન પણ એવું જ ‘વિરાટ’ બાનીમાં આસ્વાદક્ષમ બન્યું છે.

કવિને ક્યારેક વિશ્વના નિગૂઢ તત્ત્વનો અને વિસ્મયકારી અંશોનો આગસાર સ્વર્ણ છે. ત્યારે તેમનું કવિ ચિત્ત આંદોલિત થાય છે. અને અધ્યાત્મભાવના કાવ્યો સહજ રીતે પ્રગટે છે. તેઓ અતીત રાગ, વતનજુંરાપા અને પ્રકૃતિના કવિ હોવાં છતાં અધ્યાત્મભાવની કાવ્યરચનાઓમાં પણ પ્રકૃતિની સુંદરતા અને માનવતાની મધુરતાનો સમન્વય થયેદો જોવા મળે છે. કવિના અધ્યાત્મભાવનાં કાવ્યો વિશે દક્ષા વ્યાસ નોંધે છે: “ અનુભૂતિનું ઊડાણ અને અભિવ્યક્તિનું બળ-ઊભવનો સહજ સંવાદ મીરાં-કબીરની જેમ નિજાનંદમાં મસ્ત એવી નિજમાં નિમગ્ન અવસ્થાનો ભાવકને સાક્ષાત્કાર કરાવે છે. સ્થૂળ ઉદ્ગારોમાંથી સૂક્ષ્મ અનુભૂતિની પરાકાષ્ઠા સુધી આ અધ્યાત્મયાજી ભાવકને દીરી જાય છે.”

સંદર્ભ

- ક્ષાળોમાં જીવું છ (સમગ્ર કવિતા) ઈમેજ પબ્લિક્શન, મુંબઈ
- “સારસ્વત જયંત પાઠક”: દક્ષા વ્યાસ; પાર્શ્વ પબ્લિક્શન, અમદાવાદ
- પ્રાવેદી, રમેશ. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ